

Schedule XLV-Form No. 134

T10 Morma to Kachiana

मालविसरग

DIVISION

Lakhi Sarai

SUB-DIVISION

MEASUREMENT BOOK

688

પ્રમાણિત કરવામાં આવેલ છે, કે
કેસ માપીપુસ્તક નં 688 માં કુલ 100 પાના છે,
જે FDR એજન્સીમાં લેવામાં આવેલ છે,
મોડેલ 19 સે કચેરીમાં પણ લેવામાં આવેલ છે,
દેતુ એજન્સીમાંથી મે.ઈ. સંદીપ કુમાર
કે-11 માં લેવામાં આવેલ છે,


11/10/2021

Executive Engineer
Rural Works Department
Work Division, Lakhisaraj

Sch. XLV—Form No. 134

લલિતસયન DIVISION
લલિતસયન SUB-DIVISION

Measurement Book

No. 688

Name of Officer _____

Date of first entry _____

Date of last entry _____

Name to work—

Situation of work—

Agency by which work is executed—

Date of measurement—

No. and date of agreement.

(These four lines should be repeated at the commencement of the measurements relating to each work.)

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
N/W:- Motorable Road					
To 10 Moring to Kachigang					
Under Lakshmi Road					
Agency:- Departmental					
Date:-					
(1) 26:- Plv moorum filly in					
pat Hades Road Duct					
flood damage					
	3	3m	1.5	30	4.05

	5	2.4	1.4	30	5.04
	8	2.20	1.40	30	7.139
	16	3.40	2m	30	32.64
	10	2m	1.3	30	7.80
	12	3.40	2.1	30	25.70
	8	4.80	1.6	30	18.43
	20	3.40	1.8	30	36.72
	5	2.40	2	30	7.20
	8	2.20	1.40	30	7.139
	16	3.10	2.10	30	31.75
	10	2.20	1.3	30	8.58
	12	3.4	2.10	30	25.70
	8	2	1.60	30	7.68
	20	2.20	1.8	30	23.76
	5	2.40	2.40	30	7.156

Continuation

256.89
m

Sch. XLV—Form No. 134

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
					57 56.894
	87	1.90	1.90	30	= 8.66
	16	2	2.10	30	= 20.66
	1	8m	2.20	30	= 5.28
	18	2.40	2.6	30	= 33.70
	16	2.6	2m	30	= 24.98
322 16	12	3m	2m	30	= 21.60
	8	6m	2	30	= 28.80
	4	5m	2.5	30	= 15.0
	5	6m	2m	30	= 18m
	8	5m	2m	30	= 24
416	5	10m	2m	30	= 30.0
	4	12m	1.5	30	= 21.60
	8	9m	1.75	30	= 37.80

	6	7m	2m	30	= 25.20
					571.65m
P/W Laying & spreading of compacted earth in pot-Hole area					
As per schedule					
	N	m	m	m	m ³
	3	3m	1.5	20	= 2.70
	5	2.40	1.40	20	= 3.36
	8	2.20	1.40	20	= 4.93
	16	3.40	2	20	= 21.76
	10	2m	1.3	20	= 5.20
	12	3.40	2.10	20	= 17.40

Continuation

Sch. XLV—Form No. 134

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
					152
	8	4.00	1.60	1.20	= 12.29
	20	3.40	1.80	1.20	= 24.48
	5	2.4	2.0	1.20	= 4.80
	8	2.20	1.40	1.20	= 4.93
	16	3.10	2.10	1.20	= 20.03
	10	2.20	1.30	1.20	= 5.72
	12	3.40	2.10	1.20	= 17.14
	8	2	1.60	1.20	= 5.12
	20	2.20	1.80	1.20	= 15.84
	5	2.10	2.40	1.20	= 5.04
	8	1.90	1.90	1.20	= 5.28
	16	2.20	2.10	1.20	= 13.44
	10	8m	2.20	1.20	= 3.52
	18	2.40	2.60	1.20	= 22.48
	16	2.6	2.0	1.20	= 16.64
35/11	12	3m	2m	1.20	= 14.40
	8	6m	2m	1.20	= 19.20
	4	5m	2.5	1.20	= 10.0
	5	6m	2m	1.20	= 12.0
	8	5	2m	1.20	= 16.0
4/11	5	10m	2.20	1.20	= 20.1
	4	12	1.5	1.20	= 14.40
	8	9m	1.75	1.20	= 25.20
	6	7m	2.0	1.20	= 16.80
					381.12

Continuation
 15/11/2001
 S.E.
 15/11/2001
 A.E.

Length here to
flood = 1.221 km

4

Sch. XLV—Form No. 134

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
Mahar 45B					
26.5 x 9.5 = 170.75 yd					
9.5 x 2.38 = 22.61 yd					
Local sum 195.13 yd					
Moore 685.98 B					
Awarded of cut for Movable flow Top Movable Under Lake side Bed					

1) PN Morn filipina
Hole for ad
P2 = 57/1.65 m3
C 1038.53/1.59/960.

2. PN Leaf sprout Cynu
GSA II is pot Holey and
Asps sprout Cynu
P3 = 38/1.12 m
C 1475.49/1.56/2339.
1/154299=0
1/1543=0
1/138515=0
1/1304357=0

Continuation

[illegible]**Continuation**